



જનસંપર્ક અધિકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૧૦/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૩૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૯ કેસ કરી, ૫૨ વ્યક્તિઓને ઝડપી, ૨૧૫ લીટર દેશી દારૂ, ૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૫૫ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧ સ્ફૂટર અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૫ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૫૦૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૪૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૦૪૧/૧૮

**સેટેલાઇટ:** કાળુભાઈ અરજણભાઈ પટેલ (રહે. સત્યાગ્રહ છાવણી સોસાયટી હોટલ કોટયાઈ મેરીયોઈ પાછળ સેટેલાઇટ) એ તા.૧૮/૧૦/૧૮ નારોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૧૦/૧૮ કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે આરોપી ધીમંતભાઈ મહેન્દ્રભાઈ ગૌસ્વામી (રહે. ખોડીયારવાસ મ્યુ.સ્કુલની સામે હાઇકોર્ટ પાછળ સોલા ગામ) એ કાળુભાઈ પટેલની હ્યુડાઈ કંપનીની ટ્વકશન ગાડી નંબર જીજે ૨૭ સીએફ ૦૭૧૭ કિંમત રૂપિયા ૨૮,૦૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૦,૫૦,૦૦૦/- લઈ જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જી.પરમાર ચલાવે છે.

**નારોલ:** કૃણાલભાઈ કનૈયાલાલ પટેલ (રહે.આઈસીબીસીટી વંદેમાતરમ ટાઉનસીટી સોલા) એ તા.૧૮/૧૦/૧૮ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૨/૧૭ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી આકાશભાઈ ઉર્ફે રાજદેવકિંનંદન બાંગા અને અમીત દેવકીંનંદન બાંગા (રહે. નીલદીપ ટાવર નવરંગ હાઇસ્કુલ પાસે નારણપુરા) એ ભેગા મળી ઇસનપુર ચાર રસ્તા પાસે મોતી હોટલના ખાંચામા આવેલ નાથાલાલ એસ્ટેટમા કેનેક્ષ એંજીનીયર્સ નામની ફેક્ટરી ખાતે મશીનરી ટુલ્સ કોટેશન મુજબ રૂપિયા ૫૫,૧૯,૪૫૫/- લઈ મશીનરી નહી મોકલી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી.રાહોડ ચલાવે છે.

મેઘાણીનગર: બાલા મુત્યયન તોમર (રહે.છગનજીની વાડી છેલ્લા બસ સ્ટેન્ડ મેઘાણીનગર) એ તા.૧૮/૧૦/૧૮ નારોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૯/૧૮ સાજના ૬/૩૦ થી ૭/૫૦ વાગ્યાના સુમારે મેઘાણીનગર પુજા હોસ્પિટલ ચાર રસ્તા ખાતે આવેલ એસ.બી.આઇ.બેંકના એ.ટી.એમ.સેન્ટરમાં પૈસા ભરવા ગયા હતા ત્યારે અજાણ્યા પુરૂષે પાસવર્ડ જાણી લઈ એ.ટી.એમ.કાર્ડ બદલી લઈ બીજુ કાર્ડ આપી બાલા તોમરના ખાતામાંથી રૂપિયા ૩૦,૪૦૦/- કાઢી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એસ.સિંઘવ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૦૪૨/૧૮

સરદારનગર: ખુશાલ સેવારામ નંદા (ઉ.વ.૫૨) (રહે.રાજધાની સોસાયટી માયા ટોકીઝ રોડ કુબેરનગર) તા.૧૭/૧૦/૧૮ રાતના ૯/૪૦ વાગ્યાના સુમારે જી વોર્ડથી માયા સિનેમા વચ્ચે શ્યામ સુંદર બેકરી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ખુશાલ નંદાના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ખુશાલ નંદાએ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી આર.એન.વિરાણી ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૪૩/૧૮

ઇસનપુર: અશોકભાઈ ભગવાનદાસ રાણા (રહે.ભીમનાથ કોલોની વિશાલનગર સામે ઇસનપુર) એ તા.૧૫/૧૦/૧૮ સાજના ૫/૦૦ વાગે વિશાલનગર ચોક કુલવાડી પાર્ક સામે પોતાની આયસર ગાડી નંબર જીજી ૦૧ સીવાય ૪૩૨૧ કિંમત રૂપિયા ૧,૮૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૧૬/૧૦/૧૮ સવારના ૯/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ અશોકભાઈ રાણાએ તા.૧૮/૧૦/૧૮ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વાચ.જી.માથુકીયા ચલાવે છે.

સાઈટ ઉપરથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૦૪૪/૧૮

સાબરમતી: શાંતીલાલ સવાભાઈ ખોખરીયા (ઉ.વ.૪૦) (રહે. એચ-૧ બ્લોક આશ્રય ૧૦ નામની નવી બનતી સાઇડ ખોડીયાર માતાજીના મંદીર પાસે સાબરમતી) તા.૧૮/૧૦/૧૮ રાતના સમયે સાઈટ ઉપરથી પડી જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અરવિંદભાઈ માનાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.